



H.O. : 109 to 112 - A, Super Mall, Nr. Lal Bunglow, C. G. Road, Ahmedabad - 380009
Factory : 'Ashapuri Corporate House', Navrangpura, Ahmedabad - 380009
Ph. No. : +91 79 2646 2170-71 Mob. No. : +91 63535 33711, +91 63535 33706
E-mail : account@ashapurigold.com | info@ashapurigold.com
Website : www.ashapurigold.com



Gold Ornament Ltd.
Manufacturer of Antique Jewellery

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400 001,
MH, IN.

Date: 11th April, 2024

BSE Scrip Code:-542579

Sub.- Submission of the copies of the Newspaper cuttings of the extract of the Audited Standalone Financial Results for the Quarter and Year Ended 31st March, 2024

Dear Sir/ Madam,

Pursuant to Regulation 33 and 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper cutting of the extract of Audited Standalone Financial Result for the Quarter and Year Ended 31st March, 2024 which were published in Ahmedabad Edition of, "Financial Express" (English and Gujarati Newspaper).

We hereby request you to take note of the same and update record of the Company accordingly.

Thanking you.
Yours faithfully,
For, Ashapuri Gold Ornament Limited



Dineshkumar S. Soni

Dineshkumar Saremal Soni
Managing Director
DIN: 01795746

Union Bank of India
LP Savani Road : 23, 24, Western Business Hub, Near Veerbhadravani, Pal, Surat-395009.

SCHEDULE 6 (Rule-8(1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the **Union Bank of India, LP Savani Road Branch, Surat** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act) 2002 (3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **26.12.2023** under section 13 (2) of the said act calling upon the Borrowers / Guarantor (1). **Mr. Arun Kumar Matprasadd Tiwari, (2). Mrs. Tiwari Kusumben (3). Mr. Surendra Kumar Tripathi (Guarantor)** repay the amount mentioned in the notice being **Rs. 12,80,070.27 (Rupees Twelve Lakhs Eighty Thousand Seven Hundred and Paise Twenty Seven Only)** with further interest thereon & expenses within 60 days from the date of receipt of the said notice.

The Borrowers and Guarantors having failed to repay the amount, Notice is hereby given to the Borrowers and Guarantors and public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 & 9 of the said rules on this **9th day of April of the year 2024.**

The Borrowers / Secured Debtors / Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Union Bank of India, LP Savani Road Branch, Surat** for an amount of **Rs. 12,80,070.27 (Rupees Twelve Lakhs Eighty Thousand Seven Hundred and Paise Twenty Seven Only)** with further interest thereon Plus other Charges.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that a piece and parcel of land bearing at Plot No. 101, Adm. 0 53 33 sq. yard, i.e., 44.59 sq.mt (As per KJP Block No. 88/B/101, adm. 40.22 sq.mt) and undivided share of land, Road, COP ad. 29.20 sq.mt of "Saideep Residency" situated at land bearing Block No. 88/B (as per consolidation of Block No. 88 paiki 101, 102) of Village-Jolva, Sub-district - Palsana, Dist. Surat Gujarat with all the rights title, interest and benefits there to Guarantor (1). **Mr. Arun Kumar Matprasadd Tiwari, (2). Mrs. Tiwari Kusumben**
Date : 09.04.2024, Place : Surat Authorised Officer, Union Bank of India

Union Bank of India
LP Savani Road : 23, 24, Western Business Hub, Near Veerbhadravani, Pal, Surat-395009.

SCHEDULE 6 (Rule-8(1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the **Union Bank of India, LP Savani Road Branch, Surat** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act) 2002 (3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **29.01.2024** under section 13 (2) of the said act calling upon the Borrowers / Guarantor **Mr. Sada Ram S/o Bhabur Ram (Borrower), Mrs. Anasi Devi Sada Ram (Co-borrower), Mr. Labu Ram Devasi (Guarantor)** repay the amount mentioned in the notice being **Rs. 21,57,648.20 (Rupees Twenty One Lacs Fifty Seven Thousand Six Hundred Forty Eight and Paise Twenty Only)** with further interest thereon & expenses within 60 days from the date of receipt of the said notice.

The Borrowers and Guarantors having failed to repay the amount, Notice is hereby given to the Borrowers and Guarantors and public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 & 9 of the said rules on this **9th day of April of the year 2024.**

The Borrowers / Secured Debtors / Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Union Bank of India, LP Savani Road Branch, Surat** for an amount of **Rs. 21,57,648.20 (Rupees Twenty One Lacs Fifty Seven Thousand Six Hundred Forty Eight and Paise Twenty Only)** with further interest thereon Plus other Charges.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All the piece and parcel of land bearing Plot No. 290, Adm. 72.00 Sq. Yd. (As per K.J.P Block No. 247/290, adm. 60.11 sq. mt. along with undivided share of Land, Road and COP measuring 33.42 sq. mt. of "Aradhana Green Land" situated at Block No. 247, admeasuring 42928 sq. mt. at Village - Jolva, Sub District - Palsana, District - Surat Owned By: Mr. Sadaram Bhaburam Devasi, & Mrs. Anasidevi Sadaram Devasi.
Date : 09.04.2024, Place : Surat Authorised Officer, Union Bank of India

Union Bank of India
Athwa Lines Branch : BSNL Door Sanchar Bhavan, Karimabad, Ghod Dod Road, Surat - 395002.

SCHEDULE 6 (Rule - 8(1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the **Union Bank of India** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **30.01.2024** calling upon the Borrowers / Guarantor / Mortgagor namely **Mr. Hirpara Bharatbhai Arjanbhai (Borrower & Mortgagor), Mr. Hirpara Mansukhbhai Arjanbhai (Co-Borrower & Mortgagor) & Mr. Vavija Bharatbhai Dayabhai (Guarantor)** repay the amount mentioned in the notice being **Rs. 31,31,330.94 (Rs. Thirty One Lacs Thirty One Thousand Three Hundred Thirty and Ninety Four Paise Only)** with interest within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantor / Mortgagor having failed to repay the amount, Notice is hereby given to the Borrower / Guarantor / Mortgagor and public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of the said Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this **9th day of April of the year 2024.**

The Borrower / Guarantor / Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Union Bank of India, Athwalines Branch** for an amount of **Rs. 31,31,330.94 (Rs. Thirty One Lacs Thirty One Thousand Three Hundred Thirty and Ninety Four Paise Only)** as on 30.01.2024 in the said account together with costs and interest as aforesaid.

The Borrower's / Guarantor's / Mortgagor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All Right, Place and Parcel of the Immovable Property bearing Plot No. 173, Admeasuring 20.00 ft. x 30.00 fts. i.e. 66.66 sq. yards, i.e. 55.76 sq. mtrs. along with construction standing thereon and also along with undivided proportionate share adm. 12.00 sq. Mtrs. in the land Road, COP etc. in the society which is known as "Shantivan (Sarthana) Co - Operative Housing Society Limited, Vibhag - 1" situated on the land bearing Revenue Survey No. 185 having it's Block No. 174, adm. 13290.00 sq. mtrs. & Revenue Survey No. 185 having it's Block No. 175, adm. 7730.00 sq. mtrs., Draft T P Scheme No. 22 (Sarthana - Valank), Final Plot No. 37/B, Adm. 1299.00 sq. mtrs. Paikae, Final Plot No. 37/B of Village - Sarthana, Sub District - Puna, District - Surat in the name Mr. Hirpara Bharatbhai Arjanbhai & Mr. Hirpara Mansukhbhai Arjanbhai. **Bounded by - North : Society Road, South : Adj. Plot No. 170, East : Adj. Plot No. 174, West : Adj. Plot No. 172.**
Date : 09.04.2024, Place : Surat Authorised Officer, Union Bank of India

Canara Bank
Prahaldnagar Branch (079-26937390)
Shop No.2-3-4, Pushpak Hills, Opp. Auda Garden, Prahaldnagar Satellite, Ahmedabad-380015

DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/ GUARANTOR/MORTGAGOR
Ref: PRAHLADNAGAR/ROMI/2/2024-2025 Date: 03.04.2024

To: **Borrower: Mr. Romi Rajendra Morjaria** B 4 Doctor Society Near Sai Baba Mandir, Porbandar, Gujarat-360577
B/6 Saligram Apartment, Near Jain Temple, Bodakdev, Ahmedabad-380054
Co-Borrower: Ms. Aamee Hinaben Ganatra 704 Diamond Sunity Sadhuvasvani Road Rajkot Rajkot, Gujarat- 360005
Mortgagor: Mr. Romi Rajendra Morjaria, Ms. Aamee Hinaben Ganatra, D/1002 On 10th Floor Gini Lake Gardenz, Village Makarba, Taluka, Vejalpur, District Ahmedabad-380004

Dear Sir
Sub: Notice issued under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002.

You have availed following Loans / Credit Facilities from our Prahaldnagar Branch from time to time:

Sl. No.	Loan No.	Nature of Loan/Limit	Principal as on date 03.04.2024	Interest and other charges as on date 03.04.2024	Total Liability as on date 03.04.2024	Rate of Interest
1	160001635602	Housing Loan	Rs. 93,48,265.00	Rs. 2,19,589.00	Rs. 95,67,854.00	11.20 (Inclusive of penal interest @ 2%)

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as **NPA on 02.04.2024** Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of **as on 03.04.2024, amounts to Rs. 95,67,854.00 (Rupees Ninety five lakh sixty seven thousand Eight hundred fifty four only) in Housing Loan together with further interest and charges from 04.04.2024 further interest and charges thereon**, with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act.

Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

The demand notice had also been issued to you by Registered Post AD due to your last known address available in the Branch record.

SCHEDULE

Details of Immoveable assets

Sl.	Nature	Name of the title holder
1	All that piece and parcel of Property Flat No.D/1002 on 10th Floor admeasuring about 105.48 Sq.Mtrs. Carpet area, in together with undivided share of land admeasuring 46.86 Sq.Mtrs. in a scheme known as "GINI LAKE GARDENZ" construction on Non-agricultural land bearing Survey no. 195/3 admeasuring 4338 Sq.Mtrs. T.P Scheme no.84/B of F P no.28/1 at situate lying and being at Mouje :Village: Makarba Sim of Taluka : Vejalpur in the District Ahmedabad and Registration Sub District of Ahmedabad-4 (Palid) within State of Gujarat and said Flat No.D/1002 is bounded as under: East: Flat No. C-1002, West: Flat No. D-1001, North : Open Plot, South : Open Plot	Mr. Romi Rajendra Morjaria And Ms. Aamee Hinaben Ganatra

Date : 03/04/2024 Place : Ahmedabad Authorised Officer CANARA BANK

Canara Bank
Prahaldnagar Branch (079-26937390)
Shop No.2-3-4, Pushpak Hills, Opp. Auda Garden, Prahaldnagar Satellite, Ahmedabad-380015

DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/ GUARANTOR/MORTGAGOR
Ref: PRAHLADNAGAR/ROMI/2/2024-2025 Date: 03.04.2024

To: **Borrower: Mr. Romi Rajendra Morjaria** B 4 Doctor Society Near Sai Baba Mandir, Porbandar, Gujarat-360577
B/6 Saligram Apartment, Near Jain Temple, Bodakdev, Ahmedabad-380054
Co-Borrower: Ms. Aamee Hinaben Ganatra 704 Diamond Sunity Sadhuvasvani Road Rajkot Rajkot, Gujarat- 360005
Mortgagor: Mr. Romi Rajendra Morjaria, Ms. Aamee Hinaben Ganatra, D/1002 On 10th Floor Gini Lake Gardenz, Village Makarba, Taluka, Vejalpur, District Ahmedabad-380004

Dear Sir
Sub: Notice issued under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002.

You have availed following Loans / Credit Facilities from our Prahaldnagar Branch from time to time:

Sl. No.	Loan No.	Nature of Loan/Limit	Principal as on date 03.04.2024	Interest and other charges as on date 03.04.2024	Total Liability as on date 03.04.2024	Rate of Interest
1	160001635602	Housing Loan	Rs. 93,48,265.00	Rs. 2,19,589.00	Rs. 95,67,854.00	11.20 (Inclusive of penal interest @ 2%)

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as **NPA on 02.04.2024** Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of **as on 03.04.2024, amounts to Rs. 95,67,854.00 (Rupees Ninety five lakh sixty seven thousand Eight hundred fifty four only) in Housing Loan together with further interest and charges from 04.04.2024 further interest and charges thereon**, with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act.

Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

The demand notice had also been issued to you by Registered Post AD due to your last known address available in the Branch record.

SCHEDULE

Details of Immoveable assets

Sl.	Nature	Name of the title holder
1	All that piece and parcel of Property Flat No.D/1002 on 10th Floor admeasuring about 105.48 Sq.Mtrs. Carpet area, in together with undivided share of land admeasuring 46.86 Sq.Mtrs. in a scheme known as "GINI LAKE GARDENZ" construction on Non-agricultural land bearing Survey no. 195/3 admeasuring 4338 Sq.Mtrs. T.P Scheme no.84/B of F P no.28/1 at situate lying and being at Mouje :Village: Makarba Sim of Taluka : Vejalpur in the District Ahmedabad and Registration Sub District of Ahmedabad-4 (Palid) within State of Gujarat and said Flat No.D/1002 is bounded as under: East: Flat No. C-1002, West: Flat No. D-1001, North : Open Plot, South : Open Plot	Mr. Romi Rajendra Morjaria And Ms. Aamee Hinaben Ganatra

Date : 03/04/2024 Place : Ahmedabad Authorised Officer CANARA BANK

YES BANK
Branch Office : Park Ground Floor, Jaydev Arcade, Park Colony, Near Jugges Park, Jammagar-381008
Registered & Corporate Office : Yes Bank Limited, Yes Bank House, Off Western Express Highway, Santacruz East, Mumbai - 400055.

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY

Whereas, the undersigned being the Authorized Officer of the **Yes Bank Limited** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and exercise of powers conferred under Section 13(12), of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the Borrowers / Co-Borrowers / Mortgagors mentioned herein below to repay the amount mentioned in the notice, within 60 days from the date of notice / service of the said notice.

The Borrowers / Co-Borrowers / Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Co-Borrowers / Mortgagors and the public in general that the undersigned has taken possession of the properties described herein below on in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules.

The Borrowers / Co-Borrowers / Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of the **Yes Bank Limited** for amount mentioned below and interest & expenses thereon until the full payment.

This is to bring to your attention that under Sec. 13(8) of SARFAESI Act, where the amount of dues of the secured creditor together with all costs, charges and expenses incurred by secured creditor is tendered to the secured creditor at any time before the date of publication of notice for the public auction/tender/private treaty, the secured asset shall not be sold or transferred and no further steps shall be taken for transfer or sale of that secured asset.

S. No.	NAME OF BORROWERS/ CO-BORROWERS/ MORTGAGORS/ PROPRIETOR	DATE OF DEMAND NOTICE & O/S. DUES
1.	(1) Anil Dimeshbhai Parmar (Borrower) and (2) Gitanesh Dineshbhai Parmar (Co-Borrower) (3) Krishana Anilbhai Parmar (Co-Borrower and Mortgagor) Loan Account No. AFH053300588004	22.12.2023 Rs. 1264112.21/- being outstanding as on 22.12.2023 together with further interest at contractual rates on the aforesaid amount, incidental expenses, costs, charges, etc. incurred from 23.12.2023.
Description of the Property: All piece and parcel of immovable property bearing Sub-Plot No. 248/1 of Plot No. 248 admeasuring 59.94 sq.mtrs. Undivided share in the land of road and cop in "Yogeshwar Dham" lying and situated at Revenue Survey No. 427 admeasuring 4-88-92 of Khata no. 605 to T/3-B/10 and Final Plot no. 10 admeasuring 48892 sq.mts., T.P. Scheme No. 3/B Registration Sub District and District Jammagar, and bounded as under: East: Plot no. 249, West: Sub-Plot No. 248/2, North: Internal Road, South: Plot no. 248.		
(DATE OF POSSESSION : 09.04.2024, TYPE OF POSSESSION : SYMBOLIC POSSESSION)		
2.	(1) Arvind Kumar Pandey (Borrower and Mortgagor) and (2) Ritu Devi W/O Arvind Pandey (Co-Borrower and Mortgagor) Loan Account No. AFH053300985200 & AFH053301013393	22.12.2023 Rs. 1397656.54/- being outstanding as on 22.12.2023 together with further interest at contractual rates on the aforesaid amount, incidental expenses, costs, charges, etc. incurred from 23.12.2023.
Description of the Property: All the piece and parcel of Property bearing Plot no.97A admeasuring 85.576 sq.mtrs with construction in "Shri Hari park - 3" Situated on Revenue survey no.20/3 Jammagar area Development authority has sanctioned the layout plan and collector of Jammagar have converted in to NA land and divided in to 1 to 52 residential plot and out of plot no.9 to 11 were amalgamated and given new plot no.9 and new plot was sub plotted with 9/1 to 9/5 Village Dared District and Sub District Jammagar, and bounded as under: East: Sub plot no.9/3, West: Road, North: Road, South: Sub plot no.9/5.		
(DATE OF POSSESSION : 09.04.2024, TYPE OF POSSESSION : SYMBOLIC POSSESSION)		
3.	(1) Dudhreya Chetambhai (Borrower and Mortgagor) and (2) Dudhreya Chetali (Co-Borrower and Mortgagor) Loan Account No. AFH053300843555	30.11.2023 Rs. 1161195.58/- being outstanding as on 24.11.2023 together with further interest at contractual rates on the aforesaid amount, incidental expenses, costs, charges, etc. incurred from 25.11.2023.
Description of the Property: All the Part and parcel of All that piece and parcel of Property bearing Sub-Plot No. 18/3 of Plot No. 18, Open plot admeasuring 47.785 Sq. Mtrs, Known as "YOGESHWAR NAGAR - 2", F.P. No. 54/1 and 54/2, T.P.scheme No. 1, Revenue Survey No. 406, Registration District and Sub-District Jammagar and bounded as under: East: 7.50 mtrs road, West: Plot No. 30, North: Sub-Plot No. 18/4, South: Sub-Plot No. 18/2.		
(DATE OF POSSESSION : 09.04.2024, TYPE OF POSSESSION : SYMBOLIC POSSESSION)		
4.	(1) Nehal Pethad (Borrower) and (2) Nidhika Pethad (Co-Borrower) (3) Dimple Rajnikant Pethad (Co-Borrower and Mortgagor) and (4) Rajnikant Virchandbhai Pethad (Co-Borrower and Mortgagor) Loan Account No. MOR053300981136	26.09.2023 Rs. 2642053.27/- being outstanding as on 26.09.2023 together with further interest at contractual rates on the aforesaid amount, incidental expenses, costs, charges, etc. incurred from 27.09.2023.
Description of the Property: All piece and parcel of immovable property bearing Flat No. 106 admeasuring build up 60.09 sq.mtrs and super build up area 95.32 sq.mtrs along with 3.30 sq.mtrs north side open terrace of Rajgulk Apartment constructed on plot no.6/A/B and 7/C/A/B of N.A land bearing survey no.108/1, City survey no.6077/3 in sheet no.278 of ward no.15 located near Khodiy Colony on aerodrome road, Registration sub district and district Jammagar, and bounded as under: East: Flat No.101, West: Plot No.7/B-C, North: Plot No.1 & 2, South: Flat No.105.		
(DATE OF POSSESSION : 09.04.2024, TYPE OF POSSESSION : SYMBOLIC POSSESSION)		

Place : Jammagar Sd/- Kalpesh Rawal, Authorised Officer, YES Bank Limited

Chola
Enter a better life
CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED
Corporate Office: Chola Crest, Super B, C54 & C55, 4, Thiru VI Ka Industrial Estate, Guindy, Chennai - 600 032.

E-AUCTION SALE NOTICE (Sale Through e-bidding Only)
SALE NOTICE OF IMMOVABLE SECURED ASSETS Issued under Rule 8(6) and 9(1) of the Security Interest (Enforcement) Rules 2002.

Notice is hereby given to the PUBLIC IN GENERAL and in particular to the Borrower(s) and Guarantor(s) indicated in COLUMN (A) that the below described immovable property(ies) described in COLUMN (C) Mortgage / Charged to the secured creditor the POSSESSION of which has been taken as described in COLUMN (D) by the Authorized Officer of Housing CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED Secured Creditor, will be sold on "As is Where is", "As is what is" and "Whatever there is" as per details mentioned below - Notice is hereby given to Borrower / Mortgagor(s)/ legal heir, legal representatives (Whether Known or unknown), executor(s), administrator(s), successor(s) and assign(s) of the respective Borrower(s)/ Mortgagor(s) (Since deceased), as the case may be indicated in COLUMN (A) under Rule 8(6) of the Security Interest (Enforcement) Rules 2002. For detailed terms & conditions of the sale, please refer to the link provided in CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED secured Creditor's website i.e. https://www.cholamandalam.com & www.auctionfocus.in

SR. NO.	[A] LOAN ACCOUNT NO. NAMES OF BORROWER(S) / MORTGAGOR(S) / GUARANTOR(S)	[B] O/S. DUES TO BE RECOVERED (SECURED DEBTS)	[C] DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY / SECURED ASSET	[D] TYPE OF POSSESSION	[E & F] RESERVE PRICE (IN ₹) EARNEST MONEY DEPOSIT (IN ₹)	[G] DATE OF AUCTION & TIME
1	Loan Ac.No. XHLSSTR00002005414 Bharatbhai Vashrambhai Bhalala Shardaben Bharatbhai Bhalala Ravi Bharatbhai Bhalala All are Residing at : Plot No 43 Kum Kum Residency Kamrej, Surat Kamrej, Gujarat 394165 Also At : Plot No 128 Jyala-2 Kamrej, Surat Kamrej, Gujarat 394185	Rs. 2180655/- (Rupees Twenty One Lakh Eighty Thousand Six Hundred Fifty Five Only) as on 09-04-2024	All the Piece and Parcel of Immovable Property Bearing F Type Plot no.128 admeasuring 44.61 sq.mts along with 21.18 sq.mts, undivided share in land of road and C.O.P. in "Jyala-2" situated at Survey No.43, Block No.42, Khata No.1603 admeasuring 13081 sq. mts. of Moje village : Kamrej, Tal: Kamrej, Dist: Surat with construction on it	(Possession)	Rs.1055610/- (Rupees Ten Lakh Fifty Five Thousand Six Hundred Ten Only). Rs.105561/- (Rupees One Lakh Five Thousand Five Hundred Sixty One Only)	29-04-2024 from 02.00 P.M. to 04.00 P.M. (with automated extensions of 5 minutes each in terms of the Tender Document)
2	Loan Account No.: HL03STR000000202 Amikumar Rameshwal Bardoliwala Vidhya Bardoliwala Both are Residing at : Flat No.303, Mahakali Park, Nr. Raj Shopping Center, Surat City, Gujarat 395004 Also At New Dig, Katargam,fulpada Road, Nr. Raj Shipping Center, Surat City 395004	Rs.2238775/- (Rupees Twenty Two Lakh Thirty Eight Thousand Seven Hundred Seventy Five Only) as on 10-04-2024	All the piece and parcel of immovable property bearing FLAT NO. 204 on the 2nd floor admeasuring 51.18 sq.mts, built up area + 42.85 sq.mts. carpet area, along with undivided share in the land of "MAHAKALI PARK", SITUATE AT REVENUE SURVEY NO.165 PAKI , CITY SURVEY NO.51 ADM. 790.43 SQ.MTS, OF MOJE FULPADA, CITY OF SURAT OWN BY (1) AMIT RAMESHWAL BARDOLIWALA & (2) VIDHYAAMIT BARDOLIWALA	(Possession)	Rs.15,12000/- (Rupees Fifteen Lakh Twelve Thousand Only) Rs.1,51,200/- (Rupees One Lakh Fifty One Thousand Two Hundred Only)	29-04-2024 from 02.00 P.M. to 04.00 P.M. (with automated extensions of 5 minutes each in terms of the Tender Document)
	Loan Account No.: XHLSSTR0001941061 Ranjibhai Dnyanabhai Solanki Gansaben Girishbhai Solanki Ghodavaben Ranjibhai Solanki Girishkumar Ranjibhai Solanki All are Residing at : Plot-166,flat-304, 3rd Flr, Hemkunj Apartt. Magan Nagar-2, Katargam, Surat 395004 Also At : Plot No 121, Madhav Residency, Nr Kareli Gam, Oldpad Surat Sayan To Kim Road Kareli Gam Oldpad 394540	Rs.23,32,399/- (Rupees Twenty Three Lakh Thirty Two Thousand Three Hundred Ninety Nine Only) as on 10-04-2024	All the piece and parcel of immovable property bearing plot no.121 adm 69.17 sq.yard i.e. 57.83 sq.mts. along with 35.40 sq.mts. undivided share in the land of road & c.o.p. in "MADHAV RESIDENCY" situated at revenue survey no.337/2, block no.279/(279/121) adm. 1-68-96 sq.mts. of moje village kareli, tal. oldpad, dist.surat .with construction on it.	(Possession)	Rs.1023255/- (Rupees Ten Lakh Twenty Three Thousand Five Hundred Fifty Five Only) Rs.102325/- (Rupees One Lakh Two Thousand Three Hundred Twenty Five Only)	29-04-2024 from 02.00 P.M. to 04.00 P.M. (with automated extensions of 5 minutes each in terms of the Tender Document)

1. INSPECTION DATE : 26-04-2024
2. MINIMUM BID INCREMENT AMOUNT : Rs.10,000/-
3. Last date of submission of Bid/ EMD/ Request letter for participation is 27-04-2024 before 5 PM.

* Together with further interest as applicable in terms of loan agreement with, incidental expenses, costs, charges etc. Incurred up to the date of payment and/or realization thereof.

For any assistance related to inspection of the property, or for obtaining the Bid document for any other queries, please get in touch with Mr. Sambhajipati on his Mobile No. +91 9377583775, E-mail ID: sambhajipati@chola.murugappa.com; Mr. Mohd Abdul Qawi - 7305990872 official of CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED to the best of Knowledge and information of the Authorized Officer of CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED there are no encumbrances in respect of the above immovable properties/ secured Assets.

Sd/-
Date : 10-04-2024
Place : Surat
CHOLAMANDALAM Investment and Finance Company Limited

AU SMALL FINANCE BANK LIMITED (A Scheduled Commercial Bank)
Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381)

APPENDIX IV [SEE RULE 8(I)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the **AU Small Finance Bank Limited (A Scheduled Commercial Bank)** under the "Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act, 2002 (54 of 2002)] and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice on the date as mentioned below calling upon the borrowers to repay the amount mentioned in the said notice within 60 days from the date of receipt of the said notice as per the details given in below table:-

Name of Borrower/Co-Borrower/ Mortgagor/Guarantor/Loan A/c No.	13(2) Notice Date & Amount	Description of Mortgaged Property	Date of Possession Taken
(Loan A/C No.) L9001060118498122, Jay Abhe Kirana Store Through its Proprietor Dhanesh Gupta. Dhanesh Gupta (Co-Borrower), Shailendra Dhanesh Gupta (Co-Borrower), Smt. Suryavati Devi Gupta (Co-Borrower)	16-Nov-23 ₹ 6,69,919/- Rs. Six Lac Sixty-Nine Thousand Nine Hundred Nineteen Only as on 15-Nov-23	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At Municipal Corporation Shree Ramkrushna Complex , Shop No D-5 , Ground Floor, Situated Survey No 137/ Paikae , Plot No 79,80,81, Vill - Kadodara, Tehsil - Palsana , Dist. - Surat, Gujarat Admeasuring 16.77 Sqyds East - Flat No G-2 , West - Road , North - Shop No D - 6 , South - Shop No D - 4	05-Apr-24
(Loan A/C No.) L9001060119634059, Devam Auto Garage & Auto Parts (Borrower), Chetankumar Navneetbhai Mistry (Co-Borrower), Navantibhai Dahyabhai Mistry (Co-Borrower), Dharmeshkumar Navantibhai Mistry (Co-Borrower), Smt. Manjuben Navantibhai Mistry (Co-Borrower)	16-Nov-23 ₹ 6,38,192/- Rs. Six Lac Thirty-Eight Thousand One Hundred Ninety-Two Only as on 15-Nov-23	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At Gamtal Property Unregistered House 34 1 Desai Faliyu Near Karan Primary School Karan Gam Surat Palsana, Gujarat Admeasuring 71.1 Sqyds	05-Apr-24
(Loan A/C No.) L9001060100945052, Dipakkumar Mafatal Patel (Borrower), Smt. Shardaben Mafatal Patel (Co-Borrower), Mafatal Hargovindas Patel (Co-Borrower), Pankaj Kumar Mafatal Patel (Co-Borrower), Smt. Shardaben Mafatal Patel (Co-Borrower)	09-Mar-23 ₹ 3,77,455/- Rs. Three Lac Seventy-Seven Thousand Four Hundred Fifty-Five Only as on 8-Mar-23	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At Aodyanagar, Azad Chawk Pundra Ta. Mansa Gandhinagar,Dist- Gandhi Nagar, Gujarat. Admeasuring 854 Sq Yd	07-Apr-24

The borrower having failed to repay the amount, therefore notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein above mentioned table in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act [Act 2002] read with Rule 8 of the said rule on the date mentioned in the above table.

"The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **AU Small Finance Bank Limited (A Scheduled Commercial Bank)** for the amount and interest thereon mentioned in the above table.

Date : 10/04/2024
Place : Ahmedabad
Sd/-
Authorised Officer AU Small Finance Bank Limited

Ashapuri
Gold Ornament Ltd.
ASHAPURI GOLD ORNAMENT LIMITED
(CIN: L36910GJ2008PLC054222)
Registered Office: 109 to 112A, 1st Floor Super Mall, Nr. Lal Bunglow, C.G.Road, Ahmedabad-380009, GJ.IN.
Contact No. +91-7926462170-71 E-Mail: ashapurigold@gmail.com Website: www.ashapurigold.com

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & YEAR ENDED MARCH 31, 2024
(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended			Year Ended	
		31.03.2024 Audited	31.12.2023 Unaudited	31.03.2023 Audited	31.03.2024 Audited	31.03.2023

NOTICE
UNIVERSAL CABLES LTD
 REGD OFFICE: P.O. BIRLA WAKAS
 SATNA, MADHYA PRADESH - 485005
 Notice is hereby given that Share Certificate Nos. 20823-20833 for 265 Ordinary Shares bearing Folio No 0001857 and distinctive No. 1108857-1109151 of the Company standing registered in the names of Mudumbi Padmanabhan, Mudumbi Padmanabhan Siddharth and Veena Raghavan have been lost and that the application for the issue of duplicate share certificates in respect thereof has been made to the Company. Any person who has/have any claim in respect of the said share certificates should lodge such claim with the Company at its registered office at the address given above within one month from the date of this announcement. The Public are cautioned against dealing in anyway with these shares.
 Name and address of Applicants:
 Mudumbi Padmanabhan
 Siddharth and Veena Raghavan
 Nirvana Apartments, Unit A-3, 2nd floor,
 101, Richmond Road, Bangalore 560025
 Date : 11.04.2024

આમદાવાદ, ગુરુવાર, તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૪

RailTel
 (A Govt. of India undertaking)
 (CIN: U64202DL200601107905)
 GEM/2024/AB/484702, 484704, 484714, 484719, 485036, 485051, 485054 & 485058, 485076, 485085, 485091, 485092, 485093, 485094, 485095, 485096, 485097, 485098, 485099, 485100, 485101, 485102, 485103, 485104, 485105, 485106, 485107, 485108, 485109, 485110, 485111, 485112, 485113, 485114, 485115, 485116, 485117, 485118, 485119, 485120, 485121, 485122, 485123, 485124, 485125, 485126, 485127, 485128, 485129, 485130, 485131, 485132, 485133, 485134, 485135, 485136, 485137, 485138, 485139, 485140, 485141, 485142, 485143, 485144, 485145, 485146, 485147, 485148, 485149, 485150, 485151, 485152, 485153, 485154, 485155, 485156, 485157, 485158, 485159, 485160, 485161, 485162, 485163, 485164, 485165, 485166, 485167, 485168, 485169, 485170, 485171, 485172, 485173, 485174, 485175, 485176, 485177, 485178, 485179, 485180, 485181, 485182, 485183, 485184, 485185, 485186, 485187, 485188, 485189, 485190, 485191, 485192, 485193, 485194, 485195, 485196, 485197, 485198, 485199, 485200, 485201, 485202, 485203, 485204, 485205, 485206, 485207, 485208, 485209, 485210, 485211, 485212, 485213, 485214, 485215, 485216, 485217, 485218, 485219, 485220, 485221, 485222, 485223, 485224, 485225, 485226, 485227, 485228, 485229, 485230, 485231, 485232, 485233, 485234, 485235, 485236, 485237, 485238, 485239, 485240, 485241, 485242, 485243, 485244, 485245, 485246, 485247, 485248, 485249, 485250, 485251, 485252, 485253, 485254, 485255, 485256, 485257, 485258, 485259, 485260, 485261, 485262, 485263, 485264, 485265, 485266, 485267, 485268, 485269, 485270, 485271, 485272, 485273, 485274, 485275, 485276, 485277, 485278, 485279, 485280, 485281, 485282, 485283, 485284, 485285, 485286, 485287, 485288, 485289, 485290, 485291, 485292, 485293, 485294, 485295, 485296, 485297, 485298, 485299, 485300, 485301, 485302, 485303, 485304, 485305, 485306, 485307, 485308, 485309, 485310, 485311, 485312, 485313, 485314, 485315, 485316, 485317, 485318, 485319, 485320, 485321, 485322, 485323, 485324, 485325, 485326, 485327, 485328, 485329, 485330, 485331, 485332, 485333, 485334, 485335, 485336, 485337, 485338, 485339, 485340, 485341, 485342, 485343, 485344, 485345, 485346, 485347, 485348, 485349, 485350, 485351, 485352, 485353, 485354, 485355, 485356, 485357, 485358, 485359, 485360, 485361, 485362, 485363, 485364, 485365, 485366, 485367, 485368, 485369, 485370, 485371, 485372, 485373, 485374, 485375, 485376, 485377, 485378, 485379, 485380, 485381, 485382, 485383, 485384, 485385, 485386, 485387, 485388, 485389, 485390, 485391, 485392, 485393, 485394, 485395, 485396, 485397, 485398, 485399, 485400, 485401, 485402, 485403, 485404, 485405, 485406, 485407, 485408, 485409, 485410, 485411, 485412, 485413, 485414, 485415, 485416, 485417, 485418, 485419, 485420, 485421, 485422, 485423, 485424, 485425, 485426, 485427, 485428, 485429, 485430, 485431, 485432, 485433, 485434, 485435, 485436, 485437, 485438, 485439, 485440, 485441, 485442, 485443, 485444, 485445, 485446, 485447, 485448, 485449, 485450, 485451, 485452, 485453, 485454, 485455, 485456, 485457, 485458, 485459, 485460, 485461, 485462, 485463, 485464, 485465, 485466, 485467, 485468, 485469, 485470, 485471, 485472, 485473, 485474, 485475, 485476, 485477, 485478, 485479, 485480, 485481, 485482, 485483, 485484, 485485, 485486, 485487, 485488, 485489, 485490, 485491, 485492, 485493, 485494, 485495, 485496, 485497, 485498, 485499, 485500, 485501, 485502, 485503, 485504, 485505, 485506, 485507, 485508, 485509, 485510, 485511, 485512, 485513, 485514, 485515, 485516, 485517, 485518, 485519, 485520, 485521, 485522, 485523, 485524, 485525, 485526, 485527, 485528, 485529, 485530, 485531, 485532, 485533, 485534, 485535, 485536, 485537, 485538, 485539, 485540, 485541, 485542, 485543, 485544, 485545, 485546, 485547, 485548, 485549, 485550, 485551, 485552, 485553, 485554, 485555, 485556, 485557, 485558, 485559, 485560, 485561, 485562, 485563, 485564, 485565, 485566, 485567, 485568, 485569, 485570, 485571, 485572, 485573, 485574, 485575, 485576, 485577, 485578, 485579, 485580, 485581, 485582, 485583, 485584, 485585, 485586, 485587, 485588, 485589, 485590, 485591, 485592, 485593, 485594, 485595, 485596, 485597, 485598, 485599, 485600, 485601, 485602, 485603, 485604, 485605, 485606, 485607, 485608, 485609, 485610, 485611, 485612, 485613, 485614, 485615, 485616, 485617, 485618, 485619, 485620, 485621, 485622, 485623, 485624, 485625, 485626, 485627, 485628, 485629, 485630, 485631, 485632, 485633, 485634, 485635, 485636, 485637, 485638, 485639, 485640, 485641, 485642, 485643, 485644, 485645, 485646, 485647, 485648, 485649, 485650, 485651, 485652, 485653, 485654, 485655, 485656, 485657, 485658, 485659, 485660, 485661, 485662, 485663, 485664, 485665, 485666, 485667, 485668, 485669, 485670, 485671, 485672, 485673, 485674, 485675, 485676, 485677, 485678, 485679, 485680, 485681, 485682, 485683, 485684, 485685, 485686, 485687, 485688, 485689, 485690, 485691, 485692, 485693, 485694, 485695, 485696, 485697, 485698, 485699, 485700, 485701, 485702, 485703, 485704, 485705, 485706, 485707, 485708, 485709, 485710, 485711, 485712, 485713, 485714, 485715, 485716, 485717, 485718, 485719, 485720, 485721, 485722, 485723, 485724, 485725, 485726, 485727, 485728, 485729, 485730, 485731, 485732, 485733, 485734, 485735, 485736, 485737, 485738, 485739, 485740, 485741, 485742, 485743, 485744, 485745, 485746, 485747, 485748, 485749, 485750, 485751, 485752, 485753, 485754, 485755, 485756, 485757, 485758, 485759, 485760, 485761, 485762, 485763, 485764, 485765, 485766, 485767, 485768, 485769, 485770, 485771, 485772, 485773, 485774, 485775, 485776, 485777, 485778, 485779, 485780, 485781, 485782, 485783, 485784, 485785, 485786, 485787, 485788, 485789, 485790, 485791, 485792, 485793, 485794, 485795, 485796, 485797, 485798, 485799, 485800, 485801, 485802, 485803, 485804, 485805, 485806, 485807, 485808, 485809, 485810, 485811, 485812, 485813, 485814, 485815, 485816, 485817, 485818, 485819, 485820, 485821, 485822, 485823, 485824, 485825, 485826, 485827, 485828, 485829, 485830, 485831, 485832, 485833, 485834, 485835, 485836, 485837, 485838, 485839, 485840, 485841, 485842, 485843, 485844, 485845, 485846, 485847, 485848, 485849, 485850, 485851, 485852, 485853, 485854, 485855, 485856, 485857, 485858, 485859, 485860, 485861, 485862, 485863, 485864, 485865, 485866, 485867, 485868, 485869, 485870, 485871, 485872, 485873, 485874, 485875, 485876, 485877, 485878, 485879, 485880, 485881, 485882, 485883, 485884, 485885, 485886, 485887, 485888, 485889, 485890, 485891, 485892, 485893, 485894, 485895, 485896, 485897, 485898, 485899, 485900, 485901, 485902, 485903, 485904, 485905, 485906, 485907, 485908, 485909, 485910, 485911, 485912, 485913, 485914, 485915, 485916, 485917, 485918, 485919, 485920, 485921, 485922, 485923, 485924, 485925, 485926, 485927, 485928, 485929, 485930, 485931, 485932, 485933, 485934, 485935, 485936, 485937, 485938, 485939, 485940, 485941, 485942, 485943, 485944, 485945, 485946, 485947, 485948, 485949, 485950, 485951, 485952, 485953, 485954, 485955, 485956, 485957, 485958, 485959, 485960, 485961, 485962, 485963, 485964, 485965, 485966, 485967, 485968, 485969, 485970, 485971, 485972, 485973, 485974, 485975, 485976, 485977, 485978, 485979, 485980, 485981, 485982, 485983, 485984, 485985, 485986, 485987, 485988, 485989, 485990, 485991, 485992, 485993, 485994, 485995, 485996, 485997, 485998, 485999, 490000, 490001, 490002, 490003, 490004, 490005, 490006, 490007, 490008, 490009, 490010, 490011, 490012, 490013, 490014, 490015, 490016, 490017, 490018, 490019, 490020, 490021, 490022, 490023, 490024, 490025, 490026, 490027, 490028, 490029, 490030, 490031, 490032, 490033, 490034, 490035, 490036, 490037, 490038, 490039, 490040, 490041, 490042, 490043, 490044, 490045, 490046, 490047, 490048, 490049, 490050, 490051, 490052, 490053, 490054, 490055, 490056, 490057, 490058, 490059, 490060, 490061, 490062, 490063, 490064, 490065, 490066, 490067, 490068, 490069, 490070, 490071, 490072, 490073, 490074, 490075, 490076, 490077, 490078, 490079, 490080, 490081, 490082, 490083, 490084, 490085, 490086, 490087, 490088, 490089, 490090, 490091, 490092, 490093, 490094, 490095, 490096, 490097, 490098, 490099, 490100, 490101, 490102, 490103, 490104, 490105, 490106, 490107, 490108, 490109, 490110, 490111, 490112, 490113, 490114, 490115, 490116, 490117, 490118, 490119, 490120, 490121, 490122, 490123, 490124, 490125, 490126, 490127, 490128, 490129, 490130, 490131, 490132, 490133, 490134, 490135, 490136, 490137, 490138, 490139, 490140, 490141, 490142, 490143, 490144, 490145, 490146, 490147, 490148, 490149, 490150, 490151, 490152, 490153, 490154, 490155, 490156, 490157, 490158, 490159, 490160, 490161, 490162, 490163, 490164, 490165, 490166, 490167, 490168, 490169, 490170, 490171, 490172, 490173, 490174, 490175, 490176, 490177, 490178, 490179, 490180, 490181, 490182, 490183, 490184, 490185, 490186, 490187, 490188, 490189, 490190, 490191, 490192, 490193, 490194, 490195, 490196, 490197, 490198, 490199, 490200, 490201, 490202, 490203, 490204, 490205, 490206, 490207, 490208, 490209, 490210, 490211, 490212, 490213, 490214, 490215, 490216, 490217, 490218, 490219, 490220, 490221, 490222, 490223, 490224, 490225, 490226, 490227, 490228, 490229, 490230, 490231, 490232, 490233, 490234, 490235, 490236, 490237, 490238, 490239, 490240, 490241, 490242, 490243, 490244, 490245, 490246, 490247, 490248, 490249, 490250, 490251, 490252, 490253, 490254, 490255, 490256, 490257, 490258, 490259, 490260, 490261, 490262, 490263, 490264, 490265, 490266, 490267, 490268, 490269, 490270, 490271, 490272, 490273, 490274, 490275, 490276, 490277, 490278, 490279, 490280, 490281, 490282, 490283, 490284, 490285, 490286, 490287, 490288, 490289, 490290, 490291, 490292, 490293, 490294, 490295, 490296, 490297, 490298, 490299, 490300, 490301, 490302, 490303, 490304, 490305, 490306, 490307, 490308, 490309, 490310, 490311, 490312, 490313, 490314, 490315, 490316, 490317, 490318, 490319, 490320, 490321, 490322, 490323, 490324, 490325, 490326, 490327, 490328, 490329, 490330, 490331, 490332, 490333, 490334, 490335, 490336, 490337, 490338, 490339, 490340, 490341, 490342, 490343, 490344, 490345, 490346, 490347, 490348, 490349, 490350, 490351, 490352, 490353, 490354, 490355, 490356, 490357, 490358, 490359, 490360, 490361, 490362, 490363, 490364, 490365, 490366, 490367, 490368, 490369, 490370, 490371, 490372, 490373, 490374, 490375, 490376, 490377, 490378, 490379, 490380, 490381, 490382, 490383, 490384, 490385, 490386, 490387, 490388, 490389, 490390, 490391, 490392, 490393, 490394, 490395, 490396, 490397, 490398, 490399, 490400, 490401, 490402, 490403, 490404, 490405, 490406, 490407, 490408, 490409, 490410, 490411, 490412, 490413, 490414, 490415, 490416, 490417, 490418, 490419, 490420, 490421, 490422, 490423, 490424, 490425, 490426, 490427, 490428, 490429, 490430, 490431, 490432, 490433, 490434, 490435, 490436, 490437, 490438, 490439, 490440, 490441, 490442, 490443, 490444, 490445, 490446, 490447, 490448, 490449, 490450, 490451, 490452, 490453, 490454, 490455, 490456, 490457, 490458, 490459, 490460, 490461, 490462, 490463, 490464, 490465, 490466, 490467, 490468, 490469, 490470, 490471, 490472, 490473, 490474, 490475, 490476, 490477, 490478, 490479, 490480, 490481, 490482, 490483, 490484, 490485, 490486, 490487, 490488, 490489, 490490, 490491, 490492, 490493, 490494, 490495, 490496, 490497, 490498, 490499, 490500, 490501, 490502, 490503, 490504, 490505, 490506, 490507, 490508, 490509, 490510, 490511, 490512, 490513, 490514, 490515, 490516, 490517, 490518, 490519, 490520, 490521, 490522, 490523, 490524, 490525, 490526, 490527, 490528, 490529, 490530, 490531, 490532, 490533, 490534, 490535, 490536, 490537, 490538, 490539, 490540, 490541, 490542, 490543, 490544, 490545, 490546, 490547, 490548, 490549, 490550, 490551, 490552, 490553, 490554, 490555, 490556, 490557, 490558, 490559, 4905